



DK-002-001604

Seat No. _____

B. Com. (Sem. VI) Examination

March - 2022

Principles of Auditing-2

Faculty Code : 002

Subject Code : 001604

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : દરેક પ્રશ્નની જમણી બાજુ ગુણ દર્શાવેલ છે.

1 ઓડિટરની ફરજોની વિગતવાર ચર્ચા કરો. 20

અથવા

1 ઓડિટરની લાયકાતો અને હકો જણાવો. 20

2 ઓડિટ અહેવાલ એટલે શું ? ઓડિટ અહેવાલના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. 20

અથવા

2 ઓડિટ સર્ટિફિકેટ અને સામાજિક ઓડિટ પર વિસ્તૃત નોંધ લખો. 20

3 ડિવિડન્ડ એટલે શું ? ડિવિડન્ડના પ્રકારોની વિગતવાર ચર્ચા કરો. 15

અથવા

3 વહેંચણીપાત્ર નફો એટલે શું ? વહેંચણીપાત્ર નફાને અસર કરતા પરિબળો અને વહેંચણીપાત્ર નફા અંગે ઓડિટરની ફરજો જણાવો. 15

4 ટૂંકનોંધ લખો : (કોઈ પણ ત્રણ) 15

- (1) કમ્પ્યુટરાઈઝડ હિસાબી પદ્ધતિનું મહત્વ
- (2) ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ (EDP) અંકુશ
- (3) ચકાસણી અંગે ઓડિટરની ફરજો
- (4) પાઘડીનું મૂલ્યાંકન
- (5) જમીન અને મકાનનું મૂલ્યાંકન

ENGLISH VERSION

Instruction : Figures to the right side indicate marks.

1 Discuss Auditor's duties in detail. **20**

OR

1 State qualifications and rights of Auditor. **20**

2 What is audit report ? Explain types of audit report with example. **20**

OR

2 Write a detail note on audit certificate and social audit. **20**

3 What is dividend ? Discuss types of dividend in detail. **15**

OR

3 What is divisible profit ? State factors affecting to divisible profit and Auditor's duties towards divisible profit. **15**

4 Write short notes : (any **three**) **15**

- (1) Importance of computerized accounting system
- (2) Electronic Data Processing (EDP) Control
- (3) Auditor's duties regarding verification
- (4) Valuation of Goodwill
- (5) Valuation of Land and Building
